

ત્વરિત જાહેરાત માટે



ફોટો: સેલિના મેકોલમ (Selina McCallum)

બ્રેમ્પટન ફાયર સમુદાયને પબ્લિક આર્ટ (જાહેર કળા)થી જોડે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 11, 2022) – શહેર આસપાસ તકો ઊભી કરવાનું સ્થળ બનાવવા માગતા પબ્લિક આર્ટ પ્રોજેક્ટના ભાગ તરીકે બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (BFES) નાં સ્ટેશન 211 માં નવું મ્યુરલ (ભીંતચિત્ર) પ્રદર્શિત કરવામાં સીટી ઓફ બ્રેમ્પટન ગૌરવ અનુભવે છે. STEPS (સ્ટેપ્સ - સસ્ટેઈનેબલ થિંકિંગ એન્ડ એક્સપ્રેશન ઓન પબ્લિક સ્પેસ) પબ્લિક આર્ટની સહાયતાથી, ખુલ્લો ગ્રામ્ય વિસ્તાર દર્શાવતું, સ્થાનિક વન્યજીવન અને આ વિસ્તારના ખેતીવિષયક વારસાને ઉજવતું એક નવું સાહસિક અને રંગીન મ્યુરલ સ્થાપવામાં આવ્યું હતું.

પબ્લિક આર્ટનું નિર્માણ અને પ્રસ્તુતિ બ્રેમ્પટનના સાંસ્કૃતિક માસ્ટર પ્લાનની ચાવીરૂપ અગ્રતા છે, વૈવિધ્યસભર સર્જકો અને તેઓના સમુદાય વચ્ચે અર્થસભર અદલાબદલી સગવડમય બનાવવા માટેનું વાહન છે. BFES ની સમુદાય નિર્માણ પ્રત્યે ચાલુ કટિબદ્ધતાઓ સાથે મિશ્રિત, આ મ્યુરલ સામાજિક સ્નેહાકર્ષણ, સ્થળ સાથેના જોડાણને ટેકો આપે છે અને બ્રેમ્પટન માટે અજોડ અને આગવી ઓળખ રચવામાં ફાળો આપે છે.

સીટી ઓફ બ્રેમ્પટને STEPS સાથે કામ કર્યું હોય તેવી આ ત્રીજી પહેલ છે. ઓક્ટોબર 2021 માં, સ્ટોરફ્રન્ટ્સમાં મ્યુરલ્સ અને પસંદગીના ટ્રાફિક બોક્સીસ સાથે [ડાઉનટાઉન બ્રેમ્પટનમાં પબ્લિક આર્ટ પાઈલોટ પ્રોજેક્ટ રજૂ થયો હતો](#).

ક્લાકાર વિશે

આ નમૂના પાછળના ક્લાકાર, પામ લોસ્ટ્રાકો (Pam Lostracco), એક મ્યુરલિસ્ટ અને ગ્રાફિક ડિઝાઈનર છે જેઓનો જન્મ અને ઉછેર બ્રેમ્પટનમાં થયો હતો. તેણી બે શિષ્યવૃત્તિઓ મેળવીને OCAD માંથી સ્નાતક થઈ, અને તેણીએ બ્રાન્ડ્સ, પુસ્તકો અને ચિત્રો બનાવવા

ડિઝાઇન સ્ટુડિયોમાં કામ કર્યું છે. લોસ્ટ્રાકોએ સમગ્ર કેનેડામાં ડિસ્પ્લે પર નમૂનાઓ બનાવીને, તેણીનો ડિઝાઇન અનુભવ અને આઉટડોર્સ માટે તેણીના પ્રેમે મ્યુરલ્સ માટે તેણીનો જુસ્સો વિસ્તાર્યો છે. સ્ટેશન 211 માં મ્યુરલ ફાયર હોલના વાસ્તુશિલ્પ અને તેની આસપાસના કુદરતી વાતાવરણ સાથે એકીકૃત કરવા માટે રચવામાં આવ્યું હતું.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન એક રચના (મોઝેઈક) છે અને બ્રેમ્પટને જીવંત રહેવાનું ચાલુ રાખ્યું છે જે આના જેવા રચનાત્મક સહયોગોને આભારી છે. બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ આપણાં સમુદાયમાં સમાવિષ્ટ છે અને રહેવાસીઓ સાથે વધારે આગળ જોડાવા અને કળાની પહોંચ સૌ સુધી પહોંચાડવા તેઓના સ્ટેશન-સમાં પબ્લિક આર્ટની રજૂઆત જોવી બહુ અદ્ભુત છે.”

– પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“જાહેર ઈમારતોને પબ્લિક આર્ટ સાથે જીવંત બનતી જોવી બહુ અદ્ભુત છે. બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ સાથેનો આ રોમાંચક પ્રોજેક્ટ હકારાત્મકતા અને સામુદાયિક સંબંધોને બહુ વધારે પોષવામાં મદદરૂપ થશે. આ સુંદર નમૂનો બનાવવા બદલ પામ લોસ્ટ્રાકો (Pam Lostracco) નો આભાર.”

– રોવિના સાન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; ઉપ-પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન; કાઉન્સિલ પેનલના સભ્ય, આર્ટ્સ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી

“બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, આપણી સાંસ્કૃતિક ટીમ અને STEPS સાથેનો આ પ્રોજેક્ટ પરિપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે કે ચડિયાતો સહયોગ સમુદાયમાં શું લાવી શકે છે. આ મ્યુરલ્સ આપણાં ફાયર સ્ટેશન-સને તેઓની આસપાસની જગ્યાઓમાં સુરક્ષા, સંબંધ નિર્માણ અને રચનાત્મકતાની જગ્યાઓ તરીકે જોડશે, જે આપણાં ગતિશીલ સમુદાયમાં ફાળો આપશે.”

– ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણી સમગ્ર બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ટીમ શિક્ષણ, જોડાણ અને સુરક્ષા મારફતે સમુદાય સાથે કાયમી સંબંધો બાંધવા સમર્પિત છે. હું આપણાં પહેલા મ્યુરલના અનાવરણને જોવામાં રોમાંચ અનુભવું છું અને જાણું છું કે તે એકબીજા સાથે જોડાવા અને પ્રવૃત્તમય રહેવા આપણાં સમુદાયને બહુ વધારે તક પૂરી પાડશે.”

– બિલ બોયસ (Bill Boyes), ફાયર ચીફ, બ્રેમ્પટન ફાયર અને ઈમરજન્સી સેવાઓ

“STEPS આ નવા મ્યુરલને જીવંત બનાવવા સીટી ઓફ બ્રેમ્પટન અને કલાકાર પામ લોસ્ટ્રાકો (Pam Lostracco) સાથે સહયોગ સાધવામાં આનંદ અનુભવે છે; આ મ્યુરલ ફ્લાવર સીટી આસપાસ સમૃદ્ધ ખેતીલાયક જમીનો અને કુદરતી વિસ્તારોનું રચનાત્મક પ્રતિબિંબ દર્શાવે છે.”

– એરિન ગ્લોવર (Erin Glover), વચગાળાના પ્રોગ્રામ ડિરેક્ટર, STEPS પબ્લિક આર્ટ

“આ પ્રોજેક્ટ મારા માટે વધારે ખાસ છે કારણ કે બ્રેમ્પટન મારું વતન છે જ્યાં હું શહેર અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની સરહદ રહ્યો હતો. જ્યારે ડિવિઝન ચીફ ઓફ ફાયર સ્ટેશન પાછળના મકાઈના ખેતરોમાં રમતા હરાણનું વર્ણન કર્યું ત્યારે, મને ખબર હતી કે બારીની ડિઝાઇન કુદરતી જીવન અને તે બારીઓમાંથી કર્મચારીઓ દ્વારા જોવામાં આવતા ખુલ્લા કુદરતી દૃશ્ય સાથે એકીકૃત હોવી જોઈતી હતી.”

– પામ લોસ્ટ્રાકો (Pam Lostracco), કલાકાર

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

ਮਿਡਿਯਾ ਸੰਪਰਕ (MEDIA CONTACT):

ਪ੍ਰਮਾਣਿਤ ਕੇਂਦਰ

ਡਿਜੀਟਲ ਮਿਡਿਯਾ ਅਤੇ ਕਮਿਊਨਿਟੀ ਐਂਗੇਜਮੈਂਟ (Media and Community Engagement)

ਸਟ੍ਰੈਟੇਜਿਕ ਸੰਵਾਦ (Strategic Communication)

ਸੀਟੀ ਓਫ਼ ਬ੍ਰਾਮਪਟਨ

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca